

નાનુભાઇ એજ્યુકેશન ફાઉન્ડેશન માર્ગદર્શિકા

પ્રિય વિદ્યાર્થીમિત્રો,

શિષ્યવૃત્તિ અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરવા માટે નીચે દર્શાવેલ માર્ગદર્શિકાને અનુસરો. જો તમને એપ્લિકેશન પ્રક્રિયા અંગે કોઇ પ્રશ્નો હોય, તો પ્રોગ્રામ નિયામકશ્રી જયેશભાઇ ચૌધરી, મોબાઇલ નંબર -9737872543 અથવા ઇમેઇલ આઇ.ડી. - Jayesh@nanubhai.org પર સંપર્ક કરવો.

માર્ગદર્શિકા

1. માત્ર વિદ્યાર્થીનીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે.
2. કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થવા જઇ રહેલ વિદ્યાર્થીનીઓ જ આ શિષ્યવૃત્તિ માટે લાયક છે.
3. ફક્ત બેચલર ડિગ્રી પ્રોગ્રામ માટે અરજી લેવામાં આવશે. નીચે બતાવેલ ડિગ્રીઓને અગ્રતા આપવામાં આવશે. આર્કિટેકચર, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લીકેશન, એન્જિનિયરિંગ (મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર, વગેરે), હોટેલ મેનેજમેન્ટ, હોમિયોપેથિક, લો, મેડીસીન, ફાર્માસ્યુટિકલ્સ, ફાર્માકોલોજી, ફિઝીકલ થેરાપી, સાયન્સ (બાયોલોજી, કેમિસ્ટ્રી, વગેરે)
4. આ બિન ડિગ્રી પ્રોગ્રામ્સ પણ ગણવામાં આવશે: નર્સિંગ
5. સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીનીઓએ રૂબરૂ બારડોલી ઓફિસમાં આવી શિષ્યવૃત્તિ કરાર પર સહી કરવી જરૂરી છે.
6. નાનુભાઇ એજ્યુકેશન ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ સમિતિ દ્વારા પસંદ કરાયેલા નામો મુનસફી રીતે પસંદ કરવામાં આવે છે અને સમિતિના તમામ નિર્ણયો આખરી ગણાશે.

પસંદગીના માપદંડો

1. જે તે ડીગ્રી માટે શિષ્યવૃત્તિ મેળવનારાની પસંદગી નાણાકીય જરૂરિયાત અને શૈક્ષણિક ગુણવત્તા એમ બન્ને પર આધારિત છે.
2. નાણાકીય જરૂરિયાત અરજદારની વાર્ષિક ઘરની આવક દ્વારા નક્કી થશે જે મામલતદાર દ્વારા આપવામાં આવેલ આવકના દાખલાની એક નકલ અરજીપત્ર સાથે જોડવી સાથે જરૂરી છે.
3. શૈક્ષણિક યોગ્યતા અરજદાર દ્વારા ધો. 10, 11 અને 12માં મેળવેલ માર્ક્સ/ટકા/ગ્રેડ દ્વારા માપવામાં આવશે. અરજદારે શિષ્યવૃત્તિ મેળવવા માટે ધોરણ 12 ની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% મેળવેલા હોવા જોઈએ.

નિર્ણય/ પસંદગીમાટેની સમયરેખા

1. સંપૂર્ણ ભરેલ અરજીઓ જોયા બાદ, શિષ્યવૃત્તિ સમિતિ અરજદારોની નાણાકીય જરૂરીયાત, શૈક્ષણિક લાયકાત અને અન્ય ઘટકો પ્રમાણે અરજદારોને રેન્ક/શોર્ટલીસ્ટ કરવામાં આવશે.
2. ધો. 12 માં મેળવેલ માર્ક્સ/ટકા/ગ્રેડ મુજબ રેન્કિંગમાં ફેરફાર થશે.
3. શિષ્યવૃત્તિ મેળવનારાઓને જૂન માસના શરૂઆતમાં જાણ કરવામાં આવશે. શિષ્યવૃત્તિ કરાર પર સહિ મોડામાં મોડી 1 જુલાઈ, 2015 સુધીમાં થવી જરૂરી છે.
4. શિષ્યવૃત્તિના પૈસા શિષ્યવૃત્તિ મેળવનાર અરજદારોને સીધે સીધા કોલેજ ફિની રસીદો અને બીજા દસ્તાવેજો અત્રે જમા કરાવ્યાં બાદ મોડામાં મોડું 15 ઓગસ્ટ સુધીમાં વિતરિત કરવામાં આવશે.

વહેંચણી/વિતરણ :

1. દરેક શિષ્યવૃત્તિની રકમ અરજદારની કોલેજની કુલ ફી (ટયુશન, છાત્રાલય, પાઠ્યપુસ્તકો, વગેરે) પર આધાર રાખે છે, પરંતુ, શિષ્યવૃત્તિની રકમ અરજદાર દીઠ વધુમાં વધુ રૂપિયા 30,000/- સુધીની રહેશે, .
2. નાનુભાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન કુલ કોલેજ ખર્ચના 90% ખર્ચ માટે જવાબદાર રહેશે અને બાકીના ખર્ચ માટે અરજદાર પોતે જવાબદાર રહેશે. એટલે કે જો કુલ કોલેજ ફી રૂ. 33,000 હશે તો નાનુભાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન વધુમાં વધુ રૂ. 30,000 સુધીની શિષ્યવૃત્તિ આપશે અને બાકીના પૈસા (ખર્ચ) માટે અરજદાર પોતે જવાબદાર રહેશે.